

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૪/૧૧/૨૦૧૬ સોમવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૦૯૮/૧૬

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૧૯ કેસ કરી, ૧૯ વ્યક્તિઓને ઝડપી ૨૯૩ લીટર દેશી દારૂ, ૧૨૫૯ બોટલ ઈંગ્લીશ દારૂ, ૨ કાર, ૧ સ્કૂટર અને ૧ મોટર સાયકલ કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૨ કેસ કરી ૧૭ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧૯,૭૮૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલાં હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૦૯૯/૧૬

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલાં હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૨૬ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

બળાત્કારની ફરીયાદ :-

સમાચાર યાદી નં.૨૧૦૦/૧૬

ચાંદખેડા : પંચમહાલની રહેવાસી ૨૯ વર્ષની પરણીતાએ તા.૧૩/૧૧/૧૬ નારોજ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૭/૦૬/૧૬ નાં કલાક ૧૧/૦૦ વાગ્યાનાં સુમારે ચાંદખેડા O.N.G.C અવની ભવન સામે આવેલ વેસ્ટર્ન કોલોનીના ખંડેર મકાનમાં આરોપી માધુભાઈ પ્રજાપતિ (જેના પુરા નામની ખબર નથી) (રહે,નરોડા) એ પરણીતાને મારી નાંખવાની ધમકી આપી, એકાંતનો લાભ લઈ જબરદસ્તીથી પરણીતાની મરજી વિરૂધ્ધ શરીર સબંધ બાંધ્યો હતો. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એમ.એમ.વાઢેર ચલાવે છે.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૨૧૦૧/૧૬

સરખેજ : મંથનભાઈ રાજેશભાઈ પટેલ (ઉ.વ.૧૯)(રહે,વંદે માતરમ આઈકોન લાઈફ લાઈન હોસ્પિટલની બાજુમાં ગોતા)એ સરખેજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૨/૧૧/૧૬ રાતના ૮/૦૦ થી ૮/૧૫ વાગ્યા દરમિયાન એસ.પી.રિંગ રોડ બોપલ સર્કલ પાસે આવેલ ઓનેસ્ટ રેસ્ટોરન્ટ આગળથી બોપલ સરકારી ટ્યુબવેલ તરફ જતાં આવેલ શિવમ સ્નેક્સ સુધી રસ્તામાં આરોપીઓ (૧)મયુર સોઢા (૨) નિકુજ પટેલ (૩) યુવરાજસિંહ (ત્રણેય રહે, ઓઢવ) ભેગામળી મંથનભાઈને વિશ્વાસમાં લઈ, તેઓનાં કુલ રૂપિયા ૧૦,૦૦,૦૦૦/- ની ચલણી નોટો વટાવી આપવાનો વિશ્વાસ ભરોસો આપી, તે નાણાં નહીં બદલી આપી, તમામ નાણાં લઈ નાસી જઈ મંથનભાઈ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એ.બી.ચૌધરી ચલાવે છે.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૨૧૦૨/૧૬

ઇસનપુર : બેલાબેન રમેશભાઈ ગેહલોત (રહે, શક્તીનગર સોસાયટી, લોટસ સ્કુલની સામે, ઇસનપુર) એ તા.૧૩/૧૧/૧૬ નારોજ ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૧/૧૧/૧૬ બપોરનાં ૩/૦૦ થી ૭/૩૦ વાગ્યા દરમ્યાન પોતાના મકાનના દરવાજાનું તાળુ તોડી, અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી, તીજોરીમાંથી એક જોડી સોનાની બુટી કિંમત રૂપિયા ૧૦,૦૦૦/-, અલગ-અલગ ડીઝાઇનની સોનાની બંગડીઓ નંગ-૫ કિંમત રૂપિયા ૪૦,૦૦૦/-, સોનાની ચેઇન નંગ-૨ કિંમત રૂપિયા ૫૦,૦૦૦/- અને સોનાની ચુની કિંમત રૂપિયા ૧,૦૦૦/- મળી કુલ રૂપિયા ૧,૦૧,૦૦૦/- મતાની ચોરી કરી લઇ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી સી.ડી.વૈશ્યક ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૨૧૦૩/૧૬

કૃષ્ણનગર : સીમાદેવી વા/ઓ રાજવીર્સિંહ પરિહાર (ઉ.વ.૨૬)(રહે, ભુમિપાર્ક સોસાયટી, પાર્શ્વનાથ ટાઉનશિપ રોડ કૃષ્ણનગર) એ કોઇ અગમ્ય કારણસર તા.૩/૦૯/૧૬ ના કલાક ૧૨/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે એસિડ પી લીધું હતું. સારવાર અર્થે તેમને સિવિલ હોસ્પિટલ દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૧૩/૧૧/૧૬ ના કલાક ૦૦/૪૫ વાગે સીમાદેવીનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી જી.કે.રાઠોડ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.